

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૨/૦૪/૨૦૧૬ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૭૬/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૧ કેસ કરી, ૨૮ વ્યક્તિઓને ઝડપી ૧૨૦ લીટર દેશી દારૂ, ૧૪૨૯ બોટલ ઇંગ્લીશ દારૂ અને ૧ રિક્ષા કબજે કરી હતી.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૭૭/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૧૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રો.હી.૯૩ મુજબ ૨૦ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

અપહરણની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૬૭૮/૧૬

વાડજ: દીશાબહેન હસમુખલાલ પરીખ (ઉ.વ.૧૬) (રહે. મોગરાવાસ પતારફળી પારડી સુરેન્દ્રનગર) ને તા. ૧૦/૪/૧૬ બપોરના ૧/૦૦ વાગ્યાના સુમારે નવાવાડજ કુન્તાપાર્ક સોસાયટી ખાતેથી આરોપી હાદીક જગદીશભાઈ જાદવ (રહે.ગોપીનાથ સોસાયટી વંદેમાતરમ સીટી ગોતા) લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઈરાદે ભગાડી લઈ ગયો છે. આ અંગેની ફરીયાદ દિશાબહેનના પિતા હસમુખલાલ પરીખે વાડજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી વી જી રાઠોડ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૬૭૯/૧૬

વેજલપુર: કૈલાશબહેન અજીતભાઈ શાહ (રહે. પુજન એપાર્ટમેન્ટ જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે મલાવ તળાવ રોડ વેજલપુર) એ તા.૧૧/૪/૧૬ નારોજ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા. ૩/૪/૧૬ સાંજના ૬/૦૦ થી તા.૧૧/૪/૧૬ બપોરના ૧૨/૪૫ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન પોતાના મકાનની બારીની ગ્રીલ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોનાનો મોતીવાળો અસોડો કિંમત રૂપિયા ૧૫,૦૦૦/-, સોનાની હીરા જડીત વિંટી કિંમત રૂપિયા ૭,૦૦૦/-, સોનાની વિંટી કિંમત રૂપિયા ૧,૦૦૦/-, એક જોડી હાથીદાંતની ચુડીઓ કિંમત રૂપિયા ૫,૦૦૦/- અને રોકડ રૂપિયા ૫૦,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ.મ.સ.ઈ.શ્રી અમરતભાઈ કાળીદાસ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૬૮૦/૧૬

સાબરમતી: સાવરમલ શર્મા (ઉ.વ.૫૫) (રહે.ગુજરાત હાઉસીંગ બોર્ડ દિગ્વિજય સિમેન્ટ ફેક્ટરી સામે કાળીગામ સાબરમતી) એ અગમ્ય કારણસર તા.૯/૪/૧૬ સાંજના ૬/૦૦ થી તા.૧૧/૪/૧૬ કલાક ૧૦/૪૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન પોતાના ઘરે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. આ અંગેની તપાસ હે.કો.શ્રી રસીકભાઈ વિઠ્ઠલભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.